

જોગર્સ પાર્ક રોડ ઉપર આવેલ આઇસર શોરૂમ પાસેથી ઓડી કારનો કાય તોડી ` ૧૨ લાખની ચોરી કરનાર આરોપીઓને ઝડપી પાડતી, સુરત શહેર કાઇમ બ્રાંચ.

સુરત શહેર ઉમરા પો.સ્ટે. વિસ્તારમાં તા.૨૧/૯/૨૦૧૯ ના રોજ કલાક ૧૯/૪૫ થી ૨૨/૧૫ દરમ્યાન ફરીયાદીશ્રીનાઓએ પોતાના શોરૂમ પાસે પોતાની ઓડી ફોર વ્હીલ કાર નંબર GJ-05-JC-9894 માં એક બ્રાઉન કલરની બેગમાં રોકડા `૧૨ લાખ મુકી પાર્ક કરેલ હતી દરમ્યાન એક ઓટો રીક્ષામાં આવેલ બે અજાણ્યા ઇસમોએ ફરીયાદીની ઓડીકારના કાય તોડી તેમાંથી ` ૧૨ લાખ રોકડ ભરેલ બેગ ચોરી કરી નાશી ગયેલ હતા જે અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં 1 ગુ.ર.નં. ૨૯૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૪૨૭ મુજબનો ગુનો દાખલ થયેલ જે ગંભીર ગુનાની નોંધ લઇ ડી.સી.બી. પો.સ્ટે.ના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી સી.સી.ટી.વી. કુટેજ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદ લઇ વર્કઆઉટમાં જોડાયેલ હતી. દરમ્યાન હે.કો. નિતેશ તનસુખભાઇ તથા અ.પો.કોન્સ. દેવેન્દ્રાન ગંભીરદાનનાઓને મળેલ બાતમી હકીકત આધારે ખ્વાજાદાના દરગાહ બડેખા ચકલા હીજડાવાડ ખાતેથી આરોપીઓ (૧)મોહમંદ હુસેન મોહમંદ યુસુફ શેખ ઉ.વ. ૩૯ રહે. ઘર નં.૧૧/૨૩૫૨, ખજુરાવાડી, નરમાવાલા બિલ્ડીંગ સામે, મુગલીસરા મેઇન રોડ,સુરત. (૨) મોહમંદ નઇમ ઇમ્તિયાઝ દાતા ઉ.વ.૩૨ રહે.ઘર નં.૧/૨૨૯૦, નવાબી મસ્જીદ સામે, હબીબશા મહોલ્લો પાસે, ખંડેરાવપુરા, નાનપુરા, સુરત શહેરનાઓને ઝડપી પાડી, તેઓની ઝડતી કરતા તેઓની પાસેથી ઉપરોક્ત ગુનાના ચોરીમા ગયેલ મુદ્દામાલની રકમ પૈકીના રોકડા ` ૭,૬૨,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ ની કિં. `૨૩,૬૦૦/- અને ગુનામાં વપરાયેલ ઓટો રીક્ષાની કિં. ` ૧૫,૦૦૦/- મળી કુલ કિં.`૮,૦૦,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોક્ત ગુન્હે વણશોધાયેલ હોય, જે શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.

ગુનાહીત ઇતિહાસ:-આરોપી (૧) મોહમંદ હુસેન મોહમંદ યુસુફ શેખ :-અગાઉ સને ૨૦૧૭ માં ઉમરા પોલીસ સ્ટેશનમા ગાડીના કાય તોડી ચોરી કરવાના ગુનામાં તથા ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે. આરોપી (૨) મોહમંદ નઇમ ઇમ્તિયાઝ દાતા સને ૨૦૧૬ માં અઠવાલાઇન્સ પો.સ્ટે.મા અપહરણના ગુનામાં તથા ૨૦૧૭ માં ગાડીના કાય તોડી ચોરી કરવાના ગુનામાં ઉમરા પોલીસ સ્ટેશનમાં તથા સને ૨૦૧૯ માં મહીધરપુરા પો.સ્ટે.માં પુરઝડપે વાહન ચલાવવાના ગુનામાં પકડાયેલ છે.